

# Lai Ja Ne Tari Sangath Song Lyrics

---

Ao kana ao ho kana ao ho kana ao kana  
Ao kana ao ho kana ao kana ao kana

Mane lai jane tari sangath  
Tara vina gamatu nathi  
He mane lai jane tari sangath  
Tara vina gamatu nathi  
He vala aave chhe tari bahu yaad  
Tara vina gamatu nathi

He mane lai ja lai ja lai ja ne lai ja  
Lai jane tari sangath  
Tara vina gamatu nathi  
Tara vina gamatu nathi

Nay ne nindara na aave jhabaki ne jagati  
Bharatlyrics.com  
Veran virah ni rat  
Nay ne nindara na aave jhabaki ne jagati  
Veran virah ni rat  
Mand mand re padi chhe prabhat  
Prabhat prabhat aa aa  
Mand mand re padi chhe prabhat  
Tara vina gamatu nathi

Mane lai ja lai ja lai ja ne lai ja  
Lai jane tari sangath  
Tara vina gamatu nathi  
Have tara vina gamtu nathi

Ho sunu vanravan ne gaayu no gondaro  
Suno yamuna no dhat  
Sunu vanravan ne gaayu no gondaro  
Suno yamuna no dhat  
Suna lage kadam na zad  
Tara vina gamatu nathi  
Suna lage kadam na zad  
Tara vina gamatu nathi

Ae kana  
 Lai ja ne lai ja ne lai ja ne lai ja  
 Lai jane tari sangath  
 Tara vina gamatu nathi  
 Have tara vina gamtu nathi

Ho kavi k'dan ke radha haju nathi manti  
 Avu kare nahi maro kaan  
 Kavi k'dan ke radha haju nathi manti  
 Avu kare nahi maro kaan  
 Radha zure chhe divas ne rat  
 Tara vina gamatu nathi  
 Radha zure chhe divas ne rat  
 Tara vina gamatu nathi

Mane lai ja lai ja lai ja ne lai ja  
 Lai jane tari sangath  
 Tara vina gamatu nahi  
 Have tara vina gamatu nathi  
 Mane tara vina gamatu nathi  
 Kana tara vina gamatu nathi.

BHARAT  
 lyrics

More Lyrics from [Naresh Navadiya Organizer](#)

## લઈ જાને તારી સંગાથ Lyrics In Gujarati

ઓ કાના ઓ હો કાના ઓ હો કાના ઓ કાના  
 ઓ કાના ઓ હો કાના ઓ કાના ઓ કાના

મને લઈ જાને તારી સંગાથ  
 તારા વિના ગમતું નથી  
 હે મને લઈ જાને તારી સંગાથ  
 તારા વિના ગમતું નથી  
 હે વાલા આવે છે તારી બહુ યાદ  
 તારા વિના ગમતું નથી

હે મને લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા  
 લઈ જાને તારી સંગાથ  
 તારા વિના ગમતું નથી  
 તારા વિના ગમતું નથી

નય ને નીદરા ન આવે ઝબકી ને જાગતી

વેરણા વિરહુ ની રાત  
 નય ને નીદરા ન આવે ઝબકી ને જાગતી  
 વેરણા વિરહુ ની રાત  
 માંડ માંડ રે પડી છે પ્રભાત  
 પ્રભાત પ્રભાત આ આ  
 માંડ માંડ રે પડી છે પ્રભાત  
 તારા વિના ગમતું નથી

મને લઇ જા લઇ જા લઇ જા ને લઇ જા  
 લઇ જાને તારી સંગાથ  
 તારા વિના ગમતું નથી  
 હવે તારા વિના ગમતું નથી

હો સૂનું વનરાવન ને ગાયુંનો ગોંદરો  
 સુનો યમુના નો ઘાટ  
 સૂનું વનરાવન ને ગાયુંનો ગોંદરો  
 સુનો યમુના નો ઘાટ  
 સૂના લાગે કદમ ના ઝાડ  
 તારા વિના ગમતું નથી  
 સૂના લાગે કદમ ના ઝાડ  
 તારા વિના ગમતું નથી

એ કાના  
 લઇ જા ને લઇ જા ને લઇ જા ને લઇ જા  
 લઇ જાને તારી સંગાથ  
 તારા વિના ગમતું નથી  
 હવે તારા વિના ગમતું નથી

હો કવિ ક્રે'દાન કે રાધા હજુ નથી માનતી  
 આવું કરે નહિ મારો કાન  
 ભારતલીરીકસ.કોમ  
 કવિ ક્રે'દાન કે રાધા હજુ નથી માનતી  
 આવું કરે નહિ મારો કાન  
 રાધા ઝૂરે છે દિવસ ને રાત  
 તારા વિના ગમતું નથી  
 રાધા ઝૂરે છે દિવસ ને રાત  
 તારા વિના ગમતું નથી

મને લઇ જા લઇ જા લઇ જા ને લઇ જા  
 લઇ જાને તારી સંગાથ  
 તારા વિના ગમતું નથી  
 હવે તારા વિના ગમતું નથી  
 મને તારા વિના ગમતું નથી  
 કાના તારા વિના ગમતું નથી.

BHARAT  
 lyrics

More Lyrics from [Naresh Navadiya Organizer](#)

BHARAT  
lyrics